

Date: 15th June, 2023

To, BSE Limited Phiroze Jeejeebhoy Tower, Dalal Street, Mumbai – 400 001

Dear Sir / Madam,

Subject: Newspaper Advertisement of extract of Audited Financial results for the Quarter and Year ended on 31st March, 2023

Ref: Security Id: MUNCAPM / Code: 511200

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement on 10<sup>th</sup> June, 2023 of extract of Audited Financial results for the Ouarter and Year ended on 31<sup>st</sup> March, 2023, in:

1. English Newspaper - The Indian Express and

2. Regional Language Newspaper (Gujarati) - Financial Express Newspaper

Kindly take the same on your record and oblige us.

Thanking You.

Yours Faithfully,

Siddharth Shantilal Jain

For, Munoth Capital Market Limited

Director

DIN: 00370650

CIN: L99999GJ1986PLC083614

#### **ARMY INSTITUTE OF LAW, MOHALI** 0172-5095336-38. E-mail:info@ail.ac.in, Website: www.ail.ac.in

**ADMISSION NOTICE LLM (One Year) 2023-24** 

- 1. Online applications are invited for admission to LLM (One Year Course) Total Seats- 15 (Army Cat- 12, Pb Cat- 02 & All India Civ Cat- 01).
- 2. Eligibility. Minimum 55% marks in BA LLB (5 years) or LLB (3 years).
- 3. Last Date to Apply- 30 Jun 2023 with fee of Rs. 2,000/-. Application

cum Admission Google Form available on college website at www.ail.ac.in

**CHANGE OF NAME** 

I HAVE CHANGED MY

NAME FROM TEJPALSINH

JAYANDRASINH VALA TO

TEJPALSINH JAYENDRASINH

**VALAHERE AFTER BE** 

KNOVINAS TEJPALSINH

JAYENDRASINH WALA.

Sd.: TEJPALSINH

JAYENDRASINH VALA

ADD: PRACHLMAN ASPIRE TOWER IO

KYTALISHIJA RAJAZZ OLIJARAZ JECO

**CHANGE OF NAME** 

I have Changed My

Old Name SAGAR

**SURYAKANT** 

**BHIKHALAL to New** 

Name SAGAR

**SURYAKANT** 

BHIKHABHAI.

Address: 18, Shri

Society, Pani Tanki

Pase, At Jawanpura,

Ta. Idar

Dist. Sabarkantha

Mrs. Lalitabeo Spousi

of Gordhanbhai

Devariya R/o. 61/B.

Manisha Co. Op.

Housing Society,

Old Padra Road.

Vadodara Have

Changed My Name

From Mrs. Lalitaben

To Mrs. Lalitaben

Gordhanbhai Devariya

And changed my Date

of Birth From 08-05-1962 To 14-01-1963. vide

Affidavit No. 7525

dated 09-06-2023.

CHANGE OF

NAME

I have changed my

name from (old name)

KHUSHBU

ANKITKUMAR

DALWADI to (new

name) KHUSHBU

PRAKASH PRAJAPATI

I will be Known as

KHUSHBU PRAKASH

PRAJAPATI (new name) Address : A-165, Manga Darshan Society, Zadeshwar, Bharuch.

**Change of Name** 

I have changed my

name to

Nilam Hetalkumar

Shah from Nilam

**Hetal Shah** 

Address: J/2, Goval

Plaza, Opp

Swaminirayan Mandir,

Judges Bunglow

Road, Vastrapur, Ahmedabad-380015.

# Classifieds , CHAHAT LODHI D/O Ved Prakash resid-ing at A - 403 Haveli Resi cum Plaza, B/h Makarpura Air Force, Vadodara-390014, have changed my name to CHAHAT LOHDI vide affidavit dated 07 Jun 2023 before Notary GM Patel Vadodara

#### **PERSONAL**

I. VIVEK M PARMAR S / O Maheshkumar Parmar born on 27/10/1991 residing at B - 203 Amar Flats.India

Colony, Hathijan, Ahmedabad-382445 have changed my name to VIVEKKUMAR MAHESHKUMAR PARMAR vide affidavit dated 31/10/2022 at Ahmedabad.

0050220565-1

Rajyog Astro (On The Spot Result) Love Problem, Business, Husband Wife Dispute, Relationship, Love Marriage, Divorce, Court Case, Property Dispute, Depression Family/Enemy/Money Problem,On Call Solution Ahmedabad.9998929978

## CHANGE IN NAME

I the undersigned BHART KAMLESH PATEL Declares that I have change my name from BHARTIBEN KANLESH PATEL to BHARTI KANLESH PATEL and now onwards I will be know as BHARTI KANLESH PATE,

BHARTI KAMLESH PATEL Rajkot Dt.10-06-2023

## CHANGE OF NAME

I THE UNDERSIGNED BHAVNABEN ANILBHAI ARAIYA HEKE BY DECLARE THA HIMF CHINGED HIT NAME FROM BHEATSHABEN ANTERHAL BARAIYA 10 BHAVNABEN ANILBHAI BARAMA NON MANNO 3E ELLOW 12 GRAMO AS BHAWNABEN ANILBHAI

#### ANILBHAI BARAIYA RAJKOT DT. 10/06/2023 CHANGE OF NAME

BHAVNABEN

THAVE CHANGED MY NAME FROM ANNAPURNABA JAYANDRASINH VALATO AMNAPURNABA JAYENDRASINH WALAHEREAFTEREE

KNOWN AS ANNAPURNABA

JAYENDRASINH WALA. Sd.: ANNAPURNABA JAYENDRASINH VALA

ADD. PRACHOMAN ASPIRE TOWER AD CANCEL ROAD SPEEDVELL WRITER.

### CHANGE OF NAME

THAVE CHANGED MY VAME FROM JAYANDRASINH KIRITSINH VALA TO JAYENDRASINH KIRITSINH VALA HERE AFTER BE KNOWN AS JAYENDRASINE KIRITSINH VALA.

Sd.: JAYENDRASINH KIRITSINH VALA ADD: PRACHOMAN ASPRE TOWER AS, KANNOT ROAD, SPEEDWELL PARTY RUD

ACTANIAHOA BAJACK GUURAK JEKKOS **EDUCATION** 

#### Do you want to crack the civil services?

re you interested to wor

s the manager of NABAR or Scientist in Krishi lighyan Kendra or India: Forest Officer? then pursue our Post Graduation oune Zyean Mades in Nation Sesource Management at Xavier Institute of Natural Researce Management Social Centry, Ahmedragar which is affiliated to Sanitribal Phale university Pune

This course is available only in

Ahmednagar.

New applications contact 162459235, 8483023859

### **IMPORTANT**

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting

on an advertisement in any

manner whatsoever.

## **JOB**



WA	ACADEMIC YEAR 2023	IEW
POST	DEPARTMENT	DATE/TIME
Professor,	Mechanical Engineering	16-06-2023 (11 am to 1 pm)
Associate	Cittl Engineering	16-06-2023 (Z pm to 6 pm)
Professor,	Computer Engineering	S. S. S. G. CONNESS.
Assistant Professor	Computer Science & Engineering (AIME)	17-06-2023 (11 am onwards)
Principal	m	17-06-2023

- The Elighthty, Educational Qualification, Experience as prescribed by University of Mumbal, AICTE & DTE from time to time Please role University Circular No. महिलाका विशिक्षक अधिकार अपन्य-र-प्रदेश, विशिक्ष - ११. प्राणिकी २०२१ for Qualification &
- Experience at the time of interview. Must bring original partificate of Qualification, Experience & Curtoral Pay olip with 2 photocopies of each & 2 Passport size

sdi-Principa



INDIRA GANDHI RASHTRIYA URAN AKADEMI Fursatganj Airfield, Distt. Amethi (U.P.)-229302

Admission opens for 2023-24 Session

IGRUA with its state - of - the- art facilities inviting Applications for AIRCRAFT MAINTENANCE ENGINEERING July 2023-24

Total Seats	GEN	SC	ST	OBC	EWS	DURATION	AGE
30	12	05	02	08	03	03 Years	Minimum 17 years

- . 10+2 (PCM) with 50%Marks aggregate in Mathematics and Physics for General category
- 10+2 (PCM) 45% Marks aggregate in Mathematics and Physics for SC/ST/OBC /EWS categories

How to Apply: Applications are to be filled online. The Application form can be reached by clicking on Registration Form available on IGRUA website: https://igrua.gov.in/AME/Aboutus.htm

Help Desk: E-mail: query-amesch@igrua.gov.in , admissionigrua@gmail.com

Last date of Registration: 30 June 2023

CBC 03104/12/0001/2324

Mobile: 9696230588

## MOTHER COMAL

#### **Motilal Oswal Home Finance Limited** CIN - U65923MH2013PLC248741

Read. Office: Motilal Oswal Tower, Rahimtullah Sayani Road. Opp. Parel ST Depot, Prabhadevi, Mumbai - 400 025, Tel: (022) 47189999 Website: www.motilaloswalhf.com, Email: hfguery@motilaloswal.com

#### **PUBLIC NOTICE**

Motilal Oswal Home Finance Limited ("MOHFL") (Earlier known as "Aspire Home Finance Corporation Limited") hereby gives notice to the borrowers namely SHAILESH HIRALAL PATEL and RINA SHAILESH PATEL (hereinafter collectively referred to as the "Borrowers") Loan Account No. LXSUR00317 180053136 to remove their personal belongings/articles from the said Secured Asset being "All that part and parcel of property situated at PLOT NO - B - 47, TYPE - B, NANDANVAN TOWNSHIP, NEAR CNG PUMP, R.S.NO. - 214, BLOCK NO. - 315 TO 320, DINDOLI, SURAT, GUJARAT - 395210" ("Secured Asset") within a period of 7 days, the physical possession of which is with MOHFL in due compliance of the provisions of SARFAESI Act, 2002. The Borrowers are further informed that in the event the Borrowers fail to remove their personal belongings/articles from the said Secured Asset within the stipulated time period of 7 days, MOHFL shall be entitled and well within its right to dispose of the said personal belongings/articles in accordance with law inte alia by holding public auction or obtaining quotations from the partie interested in buying the such assets

For Motilal Oswal Home Finance Limited Place : Mumbai **Authorised Signatory** Date: 10.06.2023

#### **ADMISSION NOTICE**

Common Entrance Test (CET-2023) for admission to Under Graduate Courses at NILD-Kolkata, SVNIRTAR-Cuttack,

NIEPMD-Chennai and PDUNIPPD-New Delhi. Institutes under the Department of Empowerment for PwDs (DIVYANGJAN)

Ministry of Social Justice & Empowerment,

Government of India.					
NAME OF THE COURSES	ELIGIBILITY				
Bachelor of Physiotherapy (BPT)	10+2 Science PCB & English				
Bachelor of Occupational Therapy (BOT)	10+2 Science PCB & English				
Bachelor in Prosthetics & Orthotics (BPO)	10+2 Science PCB/PCM & English				
l .					

## IMPORTANT DATES

Closing Date of Online Application Extended upto: 20.06.2023 (5:00 P.M)

Date of Entrance Examination: 09.07.2023 (Sunday)

For more details log on to www.niohkol.nic.in CET- 2023 Helpdesk: Tel. No: 033-25312564, Mobile: 9432772725, Email: nild.cet2023@gmail.com

davp 38113/12/0015/2324

Chairman, CET 2023

## MUNOTH CAPITAL MARKET LIMITED

Address: Shanti Nivas, Opp. Shapath-V, Nr. Karnavati Club, S.G.Road, Ahmedabad 380058 Phone: 079-26937954 | Email: info@munoth.com | Website: www.munoth.com Extract of Standalone Audited Financial Results for the Quarter and Year ended 31/03/2023

			(Rs. In Lakhs except EPS		
Sr. No.	Particulars	Quarter Ending on 31.03.2023	Year to Date Figures 31.03.2023	Corresponding Three Months Ended in the Previous Year 31.03.2022	
1	Total income from operations (net)	8.36	31.00	9.40	
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-21.49	-26.03	3.54	
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	-21.49	-26.03	3.54	
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-21.49	-26.03	3.54	
5	Total Comprehensive income for the period (after Tax)	-19.67	-23.47	4.56	
6	Equity Share Capital	89.91	89.91	89.91	
7	Face Value of Equity Share Capital	5	5	5	
8	Earnings Per Share (Basic / Diluted)	-0.24	-0.29	0.04	

Note: The above is an extract of the detailed format of Quarterly and Yearly inancial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly and Yearly Financia Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and Company website i.e. www.munoth.com For, Munoth Capital Market Limited

Date: 30/05/2023 Place: Ahmedabad

Date: 10.06.2023,

Place : Mundra

Siddharth S. Jain Director DIN: 00370650

#### WESTERN RAILWAY-E-Tender Notice

E-Tenders are invited by Divisional Ra Manager (S&T), Ratlam, Westeri Railway, for and on behalf of the President of India for the following Signalling & Telecom work. Tender No SnT\_RTM\_23\_12\_Signal Date 06.06.2023 Name of Work: Supply nstallation, testing and commissioning of S&T material in connection with Ratlam Division: Strengthening o Earthing arrangement at LC gate an quad cable between LC gates an stations Approximate Cost of Work ₹27,90,862/- (Rs.Twenty Seven Lakh Ninety Thousand Eight Hundred Sixt Two only) Cost of Tender Documen Nill Earnest Money Deposit: ₹55,800/ Completion Period: (Six) 06 Month Time & Date for Closure fo Submission of e-Tender Documents 5:00 Hrs. on 28.06.2023 Time & Dat for Opening of e-Tender: After 15:30 Hrs. on 28.06.2023 **Validity of Offer:** 60 days from opening tender. The tender car

DRM (S&T) SPA/6/1/096 Like us on: f facebook.com/WesternRlv

be viewed online at F-Tender Portal

www.ireps.gov.in and offer must be

submitted on same E-Tender Portal

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify ts contents. The Indian Express (P) Limited cannot be neld responsible for such contents, nor for any loss or damage incurred as a result of ransactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries offore sending any monies or

#### WR EXTENDS TRIPS OF FOUR PAIRS OF SPECIAL TRAINS

Train No.	From	То	Day of Run	Extended Upto
09039	Bandra Terminus	Ajmer	Wednesday	27.09.23
09040	Ajmer	Bandra Terminus	Thursday	28.09.23
09007	Valsad	Bhiwani	Thursday	28.09.23
09008	Bhiwani	Valsad	Friday	29.09.23
09037	Bandra Terminus	Barmer	Friday	29.09.23
09038	Barmer	Bandra Terminus	Saturday	30.09.23
09129	Vadodara	Haridwar	Saturday	30.09.23
09130	Haridwar	Vadodara	Sunday	01.10.23

There will be no change in Day/Timing, Halts and Composition.

For detailed information regarding timings of halts and composition, passengers may please visit www.enquiry.indianrail.gov.in

The booking for Train No. 09039, 09007, 09037 & 09129 will open from 11th June 2023 at all PRS counters & on IRCTC website. The above trains will run as Special Train on Special Fare.



**WESTERN RAILWAY** www.wr.indianrailways.gov.in Like us on: 

I facebook.com/WesternRly





PLEASE CARRY ORIGINAL ID PROOF FOR ALL RESERVED TICKETS



by Hon'ble Chief Minister Shri Bhupendrabhai Patel

**Urban Development and Urban Housing Development** 

Date: 10<sup>th</sup> June, 2023 | Time: 11:00 am Place: Rampura Circle Ground, Palanpur-Danta Highway, Palanpur, Dist - Banaskantha





Regional Office - Bhuj: First Floor, Dhanraj Building, College Road, Bhuj - Kutchh - 370 001

**SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES** 

APPENDIX- IV-A [See proviso to Rule 8 (6)]

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act,

2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor (s) that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, Physical possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", and "As is what is" & "Whatever There is" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower(s) / Mortgagor (s) / Guarantor (s) / Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & time, EMD and Bid increase Amount are mentioned below:

:	Sr. No.	Name Of Secured Creditor (Branch) / Name & address of Borrower/s / Guarantor/s / Mortgagor/s	Description of the Immovable Property with known Encumbrances, if any	Total Dues (Rs.) (As On 06.06.2023)	Date & Time of E-Auction		Possession (Symbolic /Physical)	Property Inspection Date & Time
		Mundra, Dist.: Kutch: Borrower: (1) M/s Thirumalai Coating, Proprietor: Shri Vinod K. Nair: Regd. Office at 10/B, Ashapura Complex, Bunder Road, Mundra, Dist. Kutch - 370	All That Part & Parcel of The Immoveble Property in The Name of Mr. K. Vinodkumar, situated at "Shree Ranuja Nagar Part - 4", Shop No. 07 to 11 with front passage & backside open land Plot No. 04, 05, 06, Gundala, R. S. No. 428/1 Near Gundala Village/ Makleshwar Mahadev Mandir on Mundra-Gundala Road, At: Gundala, Takuka: Mundra, District: Kutch. Area: 300.32 Sq. Mtr. Bounded by: On the North by: Plot No. 7, On the South by: Plot No. 6, On the East by: Mundra-Gundala Road, On the West by: Plot No. 31	23,39,558.86/- (Rupess Eight Lac Seventy Four Thousand Sixteen Only) + Further unapplied	27.06.2023 from 02.00 PM to 06.00 PM	Reserve Price : 16,55,000 EMD : 1,65,500 Bid Increase Amount : 10,000	Physical	01.06.2023 11.00 AM to 01.00 PM
		Thirumalai Coating), Address : Plot No. 44 S of Baroi Sim, Survey	All That Part & Parcel of The Immoveble Property in The Name of Mr. K Vinodkumar, situated at "Shree Ranuja Nagar Part - 2/A", Plot No. 74 to 79 Gundala, R. S. No. 409/2 & 412/2, Near Gundala Village/ Makleshwar Mahadev Mandir on Mundra-Gundala Road, At: Gundala, Takuka: Mundra, District: Kutch. Area: 354.81 Sq. Mtr. Bounded by: On the North by: 7.50 Mt. Wide Internal Road, On the South by: Plot No. 80, On the East by: 6.00 Mt. Wide Internal Road, On the West by: Plot No. 68, 69, 70, 72, 73 & 76	interest and charges		Reserve Price : 3,45,000 EMD : 34,500 Bid Increase Amount : 10,000		
	3.	:	All That Part & Parcel of The Immovable Property in The Name of Mr. K. Vinodkumar, situated at "Shree Ranuja Nagar Part - 2/A", Plot No. 126 & 127, Gundala R. S. No. 409/2 & 412/2, Near Gundala Village/ Makleshwar Mahadev Mandir on Mundra-Gundala Road, At: Gundala, Takuka: Mundra, District: Kutch. Area: 167.14 Sq. Mtr. Bounded by: For Plot No. 126, On the North by: Plot No. 127, On the South by: Plot No. 125, On the East by: Plot No. 140, On the West by: Internal Road, Bounded by: For Plot No. 127, On the North by: Plot No. 128, On the South by: Plot No. 126, On the East by: Plot No. 139, On the West by: Internal Road			Reserve Price : 1,65,000 EMD : 16,500 Bid Increase Amount : 10,000		

Last date of EMD submission Date is: 26.06.2023, Upto 4:00 PM For detailed terms and conditions of sale, please refer to the link provided in https://www.bankofbaroda.in/e-auction.htm and https://ibapi.in. Also, prospective bidders may contact our Mundra Branch, Dist. Kutch: M. 96876 39449 Authorized Officer, (In The Event Of Any Discrepancy Between The English Version And Vernacular (Gujarati) Language Version Of This Auction Notice, The English Version Shall Prevail)

Bank of Baroda Ahmedabad

# દાર્જિલિંગ પત્તીને બાદ કરી, ચાની અન્ય શ્રેણી માટે માગમા નોંધપાત્ર વધારો

પીટીઆઇ

કોલકત્તા, તા. ૯

ટી ટ્રેડર્સ એસોસિએશનના ા.૨૨૫.૯૯ના સરેરાશ ભાવમા (સીટીટીએ) અધિકારીએ આજે ચાની અન્ય બીજી બધી શ્રેણી માટે હતો. તેમ છતા દાર્જિલિંગ ટીએ હતો, ત્યારે ચાલુ હરાજી દરમિયાન ઓર્થોડોક્સ પત્તી અને સક્રિય રીતે કામગીરી કરી હતી. ભાવ ડસ્ટ ચાએ માગ અને રજૂઆત ગુણવત્તામા ધરખમ વધારો નોંધ્યો હતો. કુલ માગ ગયા સપ્તાહની સરખામણીમા હરાજી દરમિયાન રજૂઆત થયેલા વધેલા જથ્થા સાથે સુસંગત ૪૪.૨૩ ટકા વધી હતી. સીટીટીએ ડેટા અનુસાર કુલ રજૂઆતમા ૧,૨૬,૧૬૦ પેકેજ (૩૬,૩૯,૮૭૩ કિલો) છે, જેમાં સીટીસી પત્તીના ૪૮,૮૪૨ પેકેજ, ઓર્થોડોક્સના ૫૫,૧૩૭ પેકેજ, દાર્જિલિંગ પત્તીના ૪,૬૬૧ પેકેજ અને ડસ્ટ ચાના ૧૭,૫૨૦ પેકેજનો સમાવેશ થાય છે. સીટીસી પત્તીએ મજબૂત માગ પુરી પાડી છે અને

કલ સંબંધીત નિકાસકર્તાની કેટલીક શ્રેણીના ૧૨,૧૧૫૬૩ કિલો દીઠ રૂપ્છપરછ દેખાઇ હતી.

ઓર્થોડોક્સ રજૂઆતમા વેચાણ પામ્યા હતા. કુલ માગના મધ્યમ ભાવ શ્રેણીમા સારી માગ જણાવ્યું હતું કે દાર્જિલિંગ પત્તીને ૨૮.૨૩ ટકા સીસીટી પત્તી જોવા મળી હતી અને વિવિધ બાદ કરીને સેલ-૨૩ દરમિયાન કિલોદ દીઠ રૂા.૧૫૦ના સ્તરથી ગુણવત્તાની કુલ ૧૧,૭૨,૯૦૩ નીચે જોવામા આવ્યા હતા, જ્યારે કિલો દીઠ રૂા.૨૨૩.૬૭ના માગમા નોંધપાત્ર વધારો થયો ૪૦.૭૫ ટકા રૂા.૨૫૦થી ઉપર સરેરાશ ભાવમા વેચાઇ હતી. કુલ નક્કી થયા હતા. પશ્ચિમ ભારતે માગના ૧૦.૭૧ ટકા કિલો દીઠ માગમા સાધારણ ઘટાડો જોયો ઓફર પર સારી ચાને ટેકો આપ્યો રૂા.૧૫૦ની નીચે જોવા મળ્યા હતો, જ્યારે હિંદુસ્તાન યુનિલિવર હતા અને ૨૩.૦૭ ટકાએ ઊંચા બોલ્ડર બ્રોકન્સ અને ફેનિંગ્સ હતા.

## કેપેસાઇટ ઈન્ફ્રાપ્રોજેક્ટ બોર્ડે ભંડોળ ઉભું કરવાની યોજનાને મંજૂરી આપી

કેપેસાઇટ ઈન્ફ્રાપ્રોજેક્ટે પ્રેફરેન્શિયલ ધોરણે શેર ઇશ્યૂ કરીને રૂ પિયા ૯૬.૩ કરોડ એકત્ર કરવાની યોજનાની જાહેરાત શુક્રવારે કરી હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એકત્ર કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ તેની લાંબાગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

કેપેસાઈટ ઈન્ફ્રાપ્રોજેક્ટ ઇક્વિટી શેરોના પ્રેફરેન્શિયલ ઇશ્યુ દ્વારા રૂપિયા ૯૬.૩ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. પ જુલાઈ, ૨૦૨૩ના રોજ યોજાનારી કંપનીની ઇજીએમ દરમિયાન શેરહોલ્ડરની મંજૂરી લેવામાં આવશે, એમ કહેવામાં આવ્યું હતું. કંપનીના બોર્ડઓફડિરેક્ટર્સે ગુરૂવારે તેની બેઠકમાં આ યોજનાને મંજૂરી

## **SKIPPER**

CIN: L40104WB1981PLC033408

Reg. Off.: 3A, Loudon Street, Kolkata - 700 017, West Bengal, India Phone: (033) 2289 2327/5731, Fax: (033) 2289 5733 **Email:** investor.relations@skipperlimited.com. Website: www.skipperlimited.com

#### NOTICE TO THE SHAREHOLDERS Transfer of Unclaimed Dividend and Equity Shares of the Company to the

Investor Education and Protection Fund (IEPF) Pursuant to the provisions of Section 124 (5) and Section 124 (6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund (IEPF) Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended ("the Rules"), the Company is required to transfer the dividend remaining unpaid/unclaimed for a period of seven consecutive years to the Investor Education and Protection Fund (IEPF). The equity shares in respect of which dividend were unclaimed for seven consecutive years will also be transferred to IEPF.

In compliance with the Rules, the Company has sent individual communication to the concerned shareholders at their registered address whose dividend remained unclaimed for seven consecutive years and whose equity shares are liable to be

unclaimed for seven consecutive years and whose equity shares are liable to be transferred to the IEPF. The complete details of the concerned shareholders are present on the Company's website www.skipperlimited.com.

Shareholders are requested to forward the requisite documents, as mentioned in the said communication to the Company/ Company's Registrar and Share Transfer Agent (RTA) on or before 12th August, 2023, to claim the unclaimed dividend amount(s). In the absence of receipt of a valid claim by the shareholder, the Company would be transferring the said shares to the IEPF without further notice in accordance with the requirement of the Rules. No claim shall lie against the Company or the Company's RTA in respect of equity shares so transferred to the IEPF. Also, please note that the shareholders whose dividend amount for financial year 2015-16 remains unpaid/ unclaimed shall be transferred to the IEPF, if not claimed by the said date.

In this connection, please note the following:
In Physical form - New share certificate(s) will be issued and transferred in favour of IEFF on completion of necessary formalities. Hence, the original share certificate(s) which stand registered in your name will be deemed cancelled and non-negotiable. • In DEMAT form - The Company shall inform the depository by way of Corporate

Action for transfer of shares lying in your DEMAT account in favour of IEPF.
The shareholders may claim from IEPF Authority, both the unclaimed dividend amount and the shares transferred to IEPF Account by following the procedure mentioned in the Rules.

For any information/clarifications on this matter, concerned shareholders may write to the Company at **investor.relations@skipperlimited.com** or contact the Company's RTA - M/s. Maheshwari Datamatics Private Limited, at 23, R.N. Mukherjee Road, 5th Floor, Kolkata - 700001, Telephone - 033 2248 2248, E-mail: mdpldc@yahoo.com

Place: Kolkata

Date: 10th June, 2023 (Company Secretary & Compliance Officer)

पंजाब नैशनल बैंक 🕊 punjab national bank સર્કલ સસ્ત્ર ઓફિસ રાજકોટ (૮૩૦૪૦૦), બીજો માળ, જે.પી. સેફાયર, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

કબજા નોટિસ - ૧૩ (૪) (અચલિત મિલકત માટે)

આથી, નીચે સહી કરનાર **પંજાબ નેશનલ બેંક** ના અધિકૃત અધિકારીએ સિકયુરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨(૨૦૦૨નો એક્ટ નં. ૫૪) ની ધારા ૧૩ (૧૨) સાથે વંચાતા રૂલ ૮ દેઠળ સિકચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સેમેન્ટ) નિયમ ૨૦૦૨ ના અંતર્ગત નીચે દર્શાવેલ તારીખો કરજદારો/ જામીનદારો/ ગીરોકર્તાને ક્સિન્ટ નોટિસ જારી કરેલ હતી કે જેમાં નોટીસમાં દર્શાવેલ સદર નોટીસ પ્રાપ્ત થયાની તારીખથી ૬૦ દિવસોમાં ચૂકવવા જણાવવામાં આવ્યું હતું. કરજદારો/જામીનદારો/ ગીરોકર્તા આ રકમ ચુકવવામાં અસફળ રહેલ છે, આથી કરજદારો/ જામીનદારો/ ગીરોકર્તા અને જાહેર જૅનતાને જણાવવામાં આવે છે કે નીચે દર્શાવેલ તારીખે ઉપરોક્ત નિચમોના અંતર્ગત નિચમ ૮ ના ધારા ૧૩ (૪) ના અંતર્ગત નીચે હસ્તાક્ષર કરેલ અધિકારીએ પોતાના અધિકારથી નીચે દર્શાવેલ મિલકતનો કબજો મેળવેલ છે.

મિલકતના માલિક અને જાહેર જનતાને સામાન્ય રીતે અહીંથી ચેતવણી આપવાની કે નીચે દર્શાવેલ મિલકતો અંગે કોઈ વ્યવહાર કરવો નહીં અને મિલકતો અંગેનો કોઈપણ વ્યવહાર **પંજાબ નેશનલ બેંક** ની નીચે દર્શાવેલ બાકી રકમ અને ચડ્ત વ્યાજ તથા ખર્ચા સાથે પૂરેપુરી રકમ ન ચૂકવાય ત્યાં સુધી બોજાને આધીન રહેશે.

ગીરવે રાખેલ એસ્કચામતો આપેલા સમયમાં છો ડાવવા અંગે કરજદાર/ જામીનદાર/ ગીરોદારનું કાયદાના સેકશન૧૩ના સબ-સેકશન (૮)

ક્રમ ત્રં.	ઉધારકર્તાઓ/ જામીનદારો/ ગીરોકર્તાનું નામ અને શાખા	ડિમાન્ડ નોટિસની તારીખ અને બાકી લેણી રકમ	ચલિત અથવા અચલિત મિલકતનું વર્ણન	કબજાની તારીખ/પ્રક
٩	મે. જીગરઅલી પ્યારઅલી	डिभान्ड नोटिस	પ્રાયમરી સિક્યુરીટી : બેંકની તરફેણમાં લોન લેનારાઓ	02.09.20
	અને પ્રોપરાઈટર :	તારીખ : ૧૭.૦૨.૨૦૨૩	દ્વારા જમીનના સાદા ગીરો દ્વારા અન્ય બાબતો સાથે	
	શ્રી મીરાણી જીગરઅલી	રૂા. ૭,૮૪,૨૩૫.૫૯/-	સુરક્ષિત કરવા માટે ખેતી / પશુપાલન અને અથવા ટોળા /	સાંકેતિક
	(ઉદ્યારકર્તા)	અને તેના પરનું વ્યાજ	માછીમારી/ રેશમ ઉછેરના હેતુ માટેના સ્ટોકનું	
	શાાખા ઓફીસ :		હાઈપોથીકેશન.	
	વઢવાણ શાખા		કોલાટેરલ સિક્યુરીટી ઃ ઈકવીટેબલ મોર્ગેજ કરેલ મિલ્કત ઃ	
	(082200)		જે સીટી સર્વે નં. ૭૩/પી, રેવન્યુ સર્વે નં. ૧૯૩૧/પી,	
			પ્લોટ નં. ૧૪/પી (ઉતરીય બાજુનું બીજુ મકાન્), વિસ્તાર	
			પલ.૪૫ સ્કે. મીટર્સ, ૭૧.૧૧ સ્કે. ચાર્ડસ, દેશળભગત	
			વાવ વિસ્તાર, વઢવાણ મ્યુનિસિપલની લીમીટ ખાતે સ્થિત	
			છે. મિલ્કતની ચર્તુસિમા નીચે મુજબ છે : પૂર્વ બાજુ : તે	
			દિશા તરફનું માપ ૨૦.૦૦ ફુટ ત્યાં પ્લોટ નં. ૧૧ અને	
			સ્વતંત્ર દિવાલ, <b>પશ્ચિમ બાજુ :</b> તે દિશા તરફનું માપ ૨૦.૦૦	
			કુટ ત્યાં જાહેર રસ્તો, <b>ઉતર બાજુ :</b> તે દિશા તરફનું માપ	
			૩૨.૦૦ કુટ ત્યાં કૃષ્ણપુરી બાવાજીનું મકાન સાથે કોમન	
			દિવાલ, <b>દક્ષિણ બાજુ :</b> તે દિશા તરફનું માપૂ ૩૨.૦૦ કુટ	
			ત્યાં કૃષ્ણપુરી પૈષ્ણવનું મકાન સાથે કોમન દિવાલ	
ર	શ્રીમતી શબનમ	डिभान्ड नोटिस	<b>કોલાટેરલ સિક્યુરીટી : રહેણાંક ફલેટ :</b> જે ફલેટ નં. ૪૦૨,	0.09.20
	અબ્દુલકાદીર કુરેશી	તારીખ : ૦૭.૧૧.૨૦૨૨	વિસ્તાર ૪૯.૨૬ સ્કે. મી.બિલ્ટઅપ એરીચા અને ૬૨.૩૧	
	(ઉદ્યારકર્તા)	રૂા. ક,૧૫,૨૫૬.૨૦∕-	સ્કે. મી. ટેરેસ એરીયા, પ્લોટ નં. ૪૭૧/એ/૧ની ઉપર	સાંકેતિક
	શાાખા ઓફીસ ઃ	અને તેના પરનું વ્યાજ	બંધાચેલ 'આફરીન' તરીકે ઓળખાતા રહેણાંક ક્રમ	
	लावनगर शामा		કોમર્શીયલ કોમ્પ્લેક્ષનો ચોથો માળ, કૃષ્ણનગર, ભાવનગર	
	(086090)		મ્યુનિસિપલ કોર્પોરેશનની હૃદ ખાતે સ્થિત છે. <b>ચર્તુસિમા</b>	
			<b>નીચે મુજબ છે : ઉતર :</b> બાલ્કની, <b>દક્ષિણ :</b> એન્ટ્રન્સ, દાદર	
			અને કોમન પેસેજ, <b>પૂર્વ :</b> ટેરેસ અને પ્રભુદાસ તળાવ રોડ,	
			પશ્ચિમ: ફલેટ નં. ૪૦૧	
3	મે. અંબીકા ટ્રેડીંગ	डिभान्ड नोटिस	પ્રાથમરી સિક્યુરીટી : કાચા માલનો સ્ટોક, અર્ઘતૈયાર માલ	09.09.20
	(પ્રોપરાઈટર :	તારીખ : ૧૮.૦૩.૨૦૨૩	end and and an edge, teach teacher of the teacher	
	શ્રી ભગીરથસિંહ	३।. ५३,८२,७५३.२१/-	વેપારના વાસ્તવિક વ્યવહારોમાંથી ઉદ્ભવતા અને પૂર્ણ	સાંકેતિક
	રાજેન્દ્રસિંહ સરવૈયા)	અને તેના પરનું વ્યાજ	થચેલા વ્યહારોનું બુક કેબ્ટસ.	
	(ઉદ્યારકર્તા) શાખા ઓકીસ :		કોલાટેરલ સિક્યુરીટી : ઈકવીટેબલ મોર્ગેજ કરેલ સ્થાવર	
	लावनगर शामा		<b>મિલ્કત :</b> જે પ્લોટ નં. ૧ જેનો વિસ્તાર ૧૦૭૯.૩૭ સ્કે.	
	(086010)		મી.ની રીઝર્વ જમીન લોડીંગ અને અનલોડીંગ હેતુ સાથે	
	(00000)		૧૦૧૦.૮૮ સ્કે.મી. ની જમીન (નેટ લેન્ડ) જે બ્લોક નં.	
			રર્ુ પૈકી (રે.સ. નં. ૩૪૭ પૈકી), ગામ : ઉખરાળા, તાલુકો	
			ઃ ઘોઘા, જી. ભાવનગુર ખાતે સ્થિત છે. <b>ચર્તુસિમા નીચે</b>	
			મુજબ છે : ઉતર : સર્વે નં. ૩૪૭ની જમીન, દક્ષિણ : સર્વે	
			નં. ૩૪૬ની જમીન, <b>પૂર્વ :</b> ભાવનગર-તળાજા રોડ અને સર્વે	
			નં. ૩૪૬ ની જમીન, <b>પશ્ચિમ :</b> પ્લોટ નં. રની જમીન	

સહી/ અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેંક

તારીખ : ૦૮.૦૬.૨૦૨૩

(THIS IS ONLY AN ADVERTISEMENT FOR INFORMATION PURPOSES AND NOT A PROSPECTUS ANNOUNCEMENT. NOT FOR DISTRIBUTION OUTSIDE INDIA.)

## PRERNA INFRABUILD LIMITED

CIN: L65990GJ1988PLC010570

Our Company was originally incorporated at Ahmedabad as "Prerna Finsafe limited" on 13th April 1988 under the provisions of the Companies Act, 1956 vide Certificate of Incorporation issued by the Asst. Registrar of Companies, Gujarat. Consequent, upon the conversion of our Company into public limited company, the name of our Company was changed to "Prerna Infrabuild Limited" vide fresh certificate of incorporation dated 19th January, 2006 issued by the Registrar of

Registered Office: PRERNA, Survey No. 820/1, In lane of Panchvati Auto, Opp. Anand Dham Derasar, S.G. Road, Ahmedabad-380058. Email: info@prernagroup.com, Website: www.prernagroup.com Contact Person: Ms.Megha, Company Secretary & Compliance Officer PROMOTERS OF THE COMPANY: MR. VIJAY C. SHAH, MR. SANKET V. SHAH, MS. NALINI V SHAH, SANKÉT V SHAH HUF, VIJAY C SHAH HUF, NIYATI S SHAH, SWETAL V SHAH

#### **BASIS OF ALLOTMENT**

RIGHT ISSUE OF 2,40,85,020 EQUITY SHARES OF A FACE VALUE OF RS. 10/- EACH (THE "RIGHTS EQUITY SHARES") OF PRERNA INFRABUILD LIMITED ("OUR COMPANY" OR "PIL" OR "THE ISSUER") FOR CASH AT A PRICE OF RS. 20/- PER PREMIUM SHARE (INCLUDING A SHARE PREMIUM OF RS. 10 PER EQUITY SHARE) ("ISSUE PRICE") AGGREGATING TO RS. 48,17,00,400 I.E. ISSUE OF 2,40,85,020 EQUITY SHARES OF FACE VALUE OF RS. 10.00 EACH AT AN ISSUE PRICE OF RS 20 PER FOLUTY SHARE AGGREGATING TO RS 48 17 00 400

THE FACE VALUE OF THE EQUITY SHARES IS RS. 10/- EACH AND THE ISSUE PRICE IS RS.20\*/- EACH. ISSUE OPENED ON: MAY 02, 2023 AND ISSUE CLOSED ON: MAY 18, 2023

The prescribed advertisement in this regard was published in all editions of English national daily newspaper Financial Express, Hindi national daily newspape Jansatta on April 27 2023, where the pre-issue advertisement was published.

The Equity Shares of the Company are proposed to be listed on the MAINBOARD Platform of BSE ("BSE") in terms of the Regulation 281 read with Regulation 103(1) of the SEBI (ICDR) Regulations, 2018 as amended from time to time. Our Company has received an In-Principal approval from BSE for the listing of the Equity Shares pursuant to letter dated March 29, 2023. BSE shall be the Designated Stock Exchange for the purpose of this Issue. The trading is proposed to be commenced on June 12, 2023 (Subject to receipt of listing and trading approvals from the BSE Limited). The Issue is being made through the Fixed Price process, the allocation in the Right Issue to the Public category shall be made pursuant to Regulation 281 read with Regulation 129(4) and Regulation 253(2) of the SEBI (ICDR) Regulations, 2018, as amended from time to time, wherein a 100% of the Issue of shares to the Public, Individual Applicants, Retail Individual Investors including Corporate Bodies / Institutions irrespective of number of shares applied for shall be made available for allotment and allotment would be allowed to be met with spill-over from any of the other categories or a combination of categories at the discretion of our Company in consultation with the Registrar and the Designation Stock Exchange. Such inter-se spill over, if any, would be affected in accordance with applicable laws, rules, regulations and guidelines. All Investors procured applicant have participated in the Issue through APPLICATIONS SUPPORTED BY BLOCKED AMOUNT ("ASBA") process by providing the details of their respective bank accounts in which the corresponding application amounts were blocked by Self Certified Syndicate Banks (the "SCSBs").

SUBSCRIPTION DETAILS The Issue has received 1509 applications for 3,03,60,871 Equity Shares resulting into 126.06% subscription. The details of the applications received in the Issue (before technical rejections) are as follows:

Number of Applications Received (Before Technical Rejection & withdrawal of application): 1509

ie aetails ot applications rejected by the Registrar on technical groun	ias are detailed below:	
Category	NUMBER OF APPLICATIONS	NUMBER OF EQUITY SHARES
NON- ELIGIBLE SHAREHOLDER	223	45790
APPLIED FROM THIRD PARTY BANK ACCOUNT	1	100
APPLICATIONS RENOUNCED WITH ZERO ENTITLEMENT	6	31250
PAN MISMATCH	2	21
SUSPENDED/CLOSED CLIENT ID/DP ID	1	1
INVALID CLIENT ID- DP ID	40	10581
TOTAL	273	87743

Details of the Valid Applications Received (After Technical Rejection & Underwriter Procured Application):

Category	NUMBER OF APPLICATIONS	NUMBER OF EQUITY SHARES	
VALID APPLICATIONS	1236	30273128	

ALLOCATION: The Basis of Allotment was finalized in consultation with the Designated Stock Exchange - BSE Limited on 25th May 2023. A. The Basis of Allotment to Investors, at the Issue price of Rs. 20/- per Equity Share, was finalized in consultation with BSE. Total number of shares allotted is 2,40,85,020 Equity Shares. The category wise basis of allotment is as under:

CATEGORY WISE BASIS OF ALLOTMENT	NO. OF SHARES	NO. OF SHARES
Shares Offered (Issue Size)		24085020
Kept in Abeyance		0
Shares to be Allotted		24085020
Shares applied by Shareholders out of Entitlement	19436382	
Less: Shares rejected on Technical Reasons	0	
Shares Accepted (A)		19436382
Shares applied by Renouncees out of Entitlement	762365	
Less: Shares rejected on Technical Reasons	0	
Shares Accepted (B)		762365
Fractional Share Accepted out of Entitlement (C)		0
Total Shares Accepted		20198747
Balance Shares available for allotment for additional applied		3886273
Additional Shares applied by Shareholders	9398807	
Less : Shares rejected on Technical Reasons	87743	
Less : Partial rejection	35221	
Less : Fractional Shares	0	
Balance Additional Shares Applied	9275843	
Total Additional Shares allotted to Shareholders (D)		3886273
Additional Shares applied by Renouncees	763317	
Less: Shares rejected on Technical Reasons	0	
Less: Partial rejection	0	
Balance Additional Shares Applied	763317	
Total Additional Shares allotted to Renouncees (E)		0
Total Shares Allotted (A + B + C + D + E)		24085020

The Board of Directors of the Company at its meeting held on May 25, 2023, has taken on record the Basis of Allotment of Equity Shares, as approved by the  $Design a ted Stock Exchange\ viz.\ BSE\ and\ has\ authorized\ the\ corporate\ action\ for\ the\ allot ment\ of\ the\ Equity\ Shares\ to\ various\ successful\ applicants.$ The Equity Shares allotted to successful applicants are being credited to their beneficiary accounts subject to validation of the account details with the depositories concerned. In case the same is not received within prescribed time, investors may contact the Registrar to the Issue at the address given below. The trading is proposed to be commenced on June 12, 2023 subject to receipt of trading approvals from BSE Limited.

Note: All capitalized terms used and not defined herein shall have the respective meanings assigned to them in the Prospectus dated April 06, 2023 ("Letter Of



Date: June 10, 2023

Place: Ahmedabad

**INVESTORS PLEASE NOTE BIGSHARE SERVICES PRIVATE LIMITED** 

Office No S6-2 | 6th floor Pinnacle Business Park | Next to Ahura Centre | Mahakali Caves Road | Andheri (East) Mumbai – 400093 | Maharashtra India Tel No: 022-40430200/62638200, E-mail: rightsissue@bigshareonline.com , Investor Grievance Email: rightsissue@bigshareonline.com/info@prernagroup.com , Website: www.bigshareonline.com , SEBI Registration No.: INR000001385

> For, Prerna Infrabuild Limited On Behalf of the Board of Directors

Mr.Sanket Shah, Managing Director, DIN: 00038121

**MUNOTH CAPITAL MARKET LIMITED** 

Phone: 079-26937954 | Email: info@munoth.com | Website: www.munoth.com xtract of Standalone Audited Financial Results for the Quarter and Year ended 31/03/2023 Rs. In Lakhs except EPS Quarte Ending on Date Three Months **Figures** Ended in the **Particulars** 31.03.2023 Previous Yea 31.03.2022 8.36 31.00 1 Total income from operations (net) 9.40 -26.03 Net Profit for the period (before Tax 3.54 Exceptional and/or Extraordinary item Net Profit for the period before Tax, (after -21.49 -26.03 3.54 Exceptional and/or Extraordinary items) 3.54 Net Profit for the period after tax (after -21.49 -26.03 Exceptional and/or Extraordinary items Total Comprehensive income for the 4.56 -23.47 period (after Tax) 89.91 89.91 89.91 Equity Share Capital 7 Face Value of Equity Share Capital

Note: The above is an extract of the detailed format of Quarterly and Yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly and Yearly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and Company website i.e. www.munoth.com For, Munoth Capital Market Limited

-0.24

-0.29

0.04

Siddharth S. Jain Director DIN: 00370650 Place: Ahmedabad

ૠણ વસૂલી અપીલ અધિકરણ પ્લોટ નં. 19, પહેલો માળ, ટેલિફોન ભવન,

આર્થર બંડર રોડ, કોલાબા માર્કેટ, કોલાબા, મુંબઈ-400005

આઈ.એ.નં. 234/2022 આઈએન અપીલ (કી) નં. 493/2021 ...અપીલકર્તા

મે. ટેક્સોન ગ્લોબલ પ્રા. લિ. અને અન્ય

એસ.એ.નં. 392/2020 માં તારીખ 19.02.2021 ના રોજ નિર્ધારીત પ્રિસાઈડીંગ અધિકારી ૠણ અને વસૂલી અધિકરણ-II અમદાવાદ દ્વારા પસાર કરાચેલ અંતિમ આદેશની અપીલ.

**1. મે. ટેક્સોન ગ્લોબલ પ્રા. લિ.,** શેલ્ટર-2, ગ્રાઉન્ડ ફ્લોર, મિસુજા કોર્ટની પાછળ ાસણા રોડ , વડોદરા-390007 ...प्रतिવાદી નં. 1.

2. મોહમ્મદ એચ. ફારૂકી, 52, બીનાનગર, મનિષા ચોકડી પાસે,

વાસણા રોડ , વડોદરા-390007 નોંધ લેવી કે **એસ.એ.નં. 392/2020 માં તારીખ 19.02.2021 ના રોજ નિર્ધારીત** 

પ્રિસા**ઇડીંગ અધિકારી, ૠણ અને વસૂલી અધિકરણ-II, અમદાવાદ** દ્વારા પસાર કરાચેલ અંતિમ આદેશની અપીલ અપીલકર્તાના એડવોકેટ દ્વારા રજૂ કરવામાં આવી હતી અને આ અધિકરણમાં **અપીલ (ડી) નં. 493/2021** ના રૂપે નોંધવામાં આવી હતી. રજી. એડી. દ્વારા ઉપરોક્ત અપીલ મેંમોની સાથે નોટીસ પહોંચાડવાના ગંભીર પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રતિવાદીને મોકલવામાં આવેલા પેકેટ ટપાલ વિભાગ દ્વાર આઇટમ અપૂરતા સરનામાને લીધે પરત અને પ્રાપ્તકર્તા વગર સૂચના છોડીને જતા

**રહ્યા છે** " ની નોંધ સાથે પરત કરવામાં આવ્યા હતા. તેથી, આપની જાણે ત્વારા આ નોટીસ આપવામાં આવે છે. . અપીલ/અરજીના મેમોરેન્ડમની નકલ **એડવોકેટ વૈશાલી ભિલારે, અપીલકર્તાના** 

એડવોકેટ, 414, એ/બી, 4થો માળ, ચુસુફ બિલ્ડીંગ, હુતાત્મા ચોક, ફોર્ટ, મુંબઇ 400001 પાસેથી મેળવી શકાશે આપ નીચે સહી કરનાર સમક્ષ જવાબ, જો હોચ તો, આપવા માટે **27.07.2023 ના રોજ** 

સવારે 11.30 કલાકે ઉપસ્થિત થઈ શકો છો . <u>જો આ બાબતમાં, આપના પોતાના દ્વારા અથવા આપની તરફથી આપના એડવોકેટ</u>

દ્ધારા અથવા કાયદા દ્વારા અધિકૃત કોઈપણ વ્યક્તિ દ્વારા ઉપસ્થિત નહી રહેવામાં આવશે તો તેને આપની ગેરહાજરીમાં સાંભળવામાં અને નિર્ણય કરવામાં આવશે .

આજે તારીખ 08 જૂન, 2023 ના રોજ મારી સહી અને અધિકરણના સિક્કા હેઠળ આપવામાં આવ્યું.



તારીખ : ૦૯.૦૬.૨૦૨૩

8 Earnings Per Share (Basic / Diluted)

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય, ગાંધીનગર, सेन्ट्रल बैंक ओफ इंडिया निषमो भाज, सेन्ट्रल जेंड जिल्डींग,

વેચાણ નોટીસ

CENTRAL BANK OF INDIA લાલ દરવાજા, અમદાવાદ - ૩૮૦૦૦૧. પરિશિષ્ટ-૪ - એ (બિચમ ૮(૬) ની જોગવાઈ જુઓ) સ્થાવર મિલકતોના વેચાણ માટેની ઇ - હરાજી વેચાણ ધી સિક્યુરીટાઇપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ - ૨૦૦૨ સાથે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો - ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવોઇઓ સાથે વંચાણે લેતાં હેઠળ સ્થાવર મિલકતોનું ઇ - હરાજીથી વેચાણની નોટીસ

આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રીતે કરજદારો અને જામીનદારોને નોટીસ આપવામાં આવે છે કે નીચે આપેલ સ્થાવર મિલકત જે સિકયોર્ડ લેણદાર પાસે ગિરવે રાખેલ / ચાર્જ કરેલ છે, જેનો કબજો સિકયોર્ડ લેણદાર, **સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના** અધિકૃત અધિકારીએ લીધો છે તે **"જયાં છે", "જેમ છે" અને "જે કાંઇ છે"** તે આધારે કરજદારો અને જામીનદારો પાસેથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા બાકી રકમની વસુલાત માટે તા. ૨૬.૦૬.૨૦૨૩ ના રોજ વેચાણ કરવામાં આવશે. સંબંધિત મિલકત સામે અનામત કિંમત અને અનેસ્ટ મની ડિપોઝીટની રકમ દર્શાવેલ છે.

ઉદ્યારકર્તાઓ / જામીનદારો / ગિરવેદારોનું નામ અને શાખાની સંપર્કની વિગત	ડિમાન્ડ નોટીસ તારીખ અને બાકી રકમ	સ્થાવર મિલકતોનું વર્ણન અને પઝેશનનો પ્રકાર	અનામત કિંમત ૧૦% ઈએમડી	અધિકૃત અધિકારીનું નામ અને સંપર્ક નંબર
શ્રી હરગોવન કાનજીભાઈ રબારી અને શ્રી રાજુભાઈ કાનજીભાઈ દેસાઈ (પાટણ શાખા) (શ્રી મગા રામ, મો : ૯૯૯૮૯૭૬૨૦૮)	૧૩.૧૧.૨૦૧૮  રૂા. ૧૯,૬૫,૮૪૮.૯૮ + વ્યાજ + અન્ય ચાર્જાસ	પ્લોટ નં. ૨૨, બ્રોસર નં. ૧૧ મુજબ, આર.એસ. નં. ૨૯૦/૧, ગુંગડી પાટી, રામદેવ ટાઉનશીપ, રાજપુત હોસ્ટેલની પાસે, કેનાલ રોડની પાસે, ઊંઝા ત્રણ રસ્તા, પાર્થ રેસીડેન્સીની સામે, પાટણ - ૩૮૪૨૬૫. (પ્રત્યક્ષ પઝેશન)	Rs. 10,96,000/-  Rs. 1,09,600/-	શ્રી સંતોષ કુમાર, (મો) : હપહક્ટ૮૩૮૫૫
શ્રીમતી બબીબેન કે ચોઘરી અને શ્રી કાનજીભાઇ જી ચોઘરી (પાટણ શાખા) (શ્રી મગા રામ, મો : ૯૯૯૮૯૭૬૨૦૮)	૦૯.૦७.૨૦૧૮  રૂા. ૧७,૮૪,७૫૬/- + વ્યાજ + અન્ય ચાર્જસ	પ્લોટ નં. ૨૧, બ્રોસર નં. ૧૨ મુજબ, આર.એસ. નં. ૨૯૦/૧, ગુંગડી પાટી, રામદેવ ટાઉનશીપ, રાજપુત હોસ્ટેલની પાસે, કેનાલ રોડની પાસે, ઊંઝા ત્રણ રસ્તા, પાર્થ રેસીડેન્સીની સામે, પાટણ - ૩૮૪૨૬૫. (પ્રત્યક્ષ પઝેશન)	Rs. 11,07,000/-  Rs. 1,10,700/-	શ્રી સંતોષ કુમાર, (મો) : હપહક્ટ૮૩૮૫૫
પ્રેમવતી રાઈસ મીલ, પ્રો. તેજેન્દ્રપ્રસાદ રાજેન્દ્રભાઈ ઠક્કર (આણંદ શાખા) (શ્રી મુકેશ ખારે,	૦૧.૦૯.૨૦૨૧  રૂા. ७,७૨,૯૧,७૨૦/- + વ્યાજ + અન્ય ચાર્જીસ	જમીન અને બિલ્ડીંગ-૧, આર.એસ નં. ૩૫૫/પૈકી, ૩૬૦/પૈકી, ૩૬૧/પૈકી, એકાઉન્ટ નં. ૧૩૮૫ - હેકટર ૦-૦૬-૦૭, હેકટર ૦-૦૫-૦૪ અને હેકટર ૦-૦૫-૦૪, પ્રેમવતી રાઈસ મીલ, માલાવાડ ક્રોસીંગ, માલાવાડ રોડ, મું. લીંબાસી, તાલુકો -માતર, જીલ્લો -ખેડા. (પ્રત્થક્ષ પ્રપ્રેશન)	Rs. 1,35,18,000/-  Rs. 13,51,800/-	શ્રી મુકેશ ખારે, (મો) : ૯૯૦૯૯૨૮૮७૫
મો : ૯૯૦૯૯૨૮૯૫)		ઈન્ડસ્ટ્રીયલ ફેક્ટરી જમીન અને બિલ્ડીંગ આર. એસ. નં. ૪૩૪, એકાઉન્ટ નં. ૧૩૪૩, કુલ ક્ષેત્રફળ હેક્ટર ૦-૩૦-૩૫, મું. લીંબાસી, તાલુકો - માતર,જીલ્લો - ખેડા. (પ્રત્થક્ષ પ્રગેશન)	Rs. 1,40,00,000/-  Rs. 14,00,000/-	શ્રી મુકેશ ખારે, (મો) : ૯૯૦૯૯૨૮૯૫
		ખુલ્લી જમીન - આર. એસ. નં. ૪૩૩/ભાગ૧, તિલક રાઈસ મીલની પાછળ, ઈન્દિરાનગરીની બાજુમાં, લીંબાસી - ૩૮૭૫૨૦, તાલુકો - માતર, જીલ્લો -ખેડા. ( <b>પ્રત્યક્ષ પ્રત્રેશન)</b>	Rs. 40,00,000/-  Rs. 4,00,000/-	શ્રી મુકેશ ખારે, (મો) : ૯૯૦૯૯૨૮૮७૫
શ્રી પ્રકાશ સુરેશકુમાર બ્રહ્મભક્ર (ઉદ્યારકતાં), શ્રી સુરેશકુમાર હરમનભાઇ બ્રહ્મભક્ર (સહ-ઉદ્યારકર્તા અને મોર્ગેજર) (ઉવારસદ શાખા) (શ્રી રાજેશકુમાર, મો : ૯૯૯૮૯७૬૨૦૮)	૦૯.૦૫.૨૦૧૯  રૂા. ૧૫,૮૪,૫૫૦/- + વ્યાજ + અન્ય ચાર્જસ	શ્રી સુરેશકુમાર હરમનભાઈ બ્રહ્મભક્ર ના નામનો રહેણાંક ઘરનો કાયદેસર ગિરવે મુકેલ મિલકતનો જમીન અને ટેનામેન્ટ પરનો પ્લોટ, ફલેટ નં. ૦૯, ત્રીજો માળ, બ્લોક નં. એ, સિંમનધર પાર્ક, દિવ્ય વરાહ કો. ઓ. હાઉસીંગ સોસાયટી લિમીટેડ, જનતાનગર રોડ, પાવાપુર બસ સ્ટેન્ડ પાસે, ઘાટલોડીયા, અમદાવાદ, સર્વે નં. ૫૦/૧, ટીપીએસ નં. ૧, એક.પી. નં. ૮૬, મોજે - ઘાટલોડીયા, અમદાવાદ - ૨, વાડજ. (પ્રત્થક્ષ પ્રપ્રેશન)	Rs. 27,40,000/-  Rs. 2,74,000/-	શ્રી સંજય લોહછાબ, (મો) : ૯૯૦૯૯૨૨૯૮૬
શ્રી રવિ સેન (ઉદ્યારકર્તા અને મોર્ગેજર) \$/0 ભેરુલાલ સેન, શ્રીમતી ભુરી રવિ સેન (સહ-ઉદ્યારકર્તા) W/0 રવિ સેન (આઈઆઈટી શાખા) (શ્રી જીફેશ ખડાયતા, મો : ૯૯૦૯૨૨૯૮૬)	os.oહ.૨૦૨૨  રૂા. ૨,૪૦,૧૨૮.૦૩ + વ્યાજ + અન્ય યાર્જીસ	શ્રી રિવ સેન અને શ્રીમતી ભૂરી સેન ના નામનો કાયદેસર ગિરવે મુકેલ મિલકતનો ફલેટ નં. પી/૨૦૭, પહેલો માળ, બ્લોક - પી, ગેલેશી ફલેટ - ફેઝ - ૩ થી જાણીતી સ્કીમ, યોજના બાંધવામાં આવેલ, ફ્રી હોલ્ડ બીન - ખેતીલાયક જમીનનો બ્લોક નં.૯૮૦ + ૯૮૧, મોજે -છત્રાલ, ક્લોલ. (પ્રત્થક્ષ પ્રપ્રેશન)	Rs. 4,25,000/-  Rs. 42,500/-	શ્રી સંજય લોહછાબ, (મો) : ૯૯૦૯૯૨૨૯૮૬

નિરીક્ષણની તારીખ અને સમય : ૨૧.૦૬.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૪.૦૦ કલાકે ઈએમડી અને ડોક્યુમેન્ટ (ઓનલાઈન) જમા કરાવવાની છેલ્લી તારીખ અને સમય : તા. ૨૫.૦૬.૨૦૨૩ ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ઈ - હરાજી ની તારીખ : ૨૬.૦૬.૨૦૨૩, સમય : બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ ક્લાક સુધી ૧૦ મિનિટના ઓટો - એક્સટેન્સન સાથે

હરાજી બેંકના માન્ય સેવા પ્રદાતા https://www.mstcecommerce.com કારા હાથ ધરવામાં આવશે. બિડરોએ https://www.mstcecommerce.com પર રજીસ્ટર્ડ કરીને KYC દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. સર્વિસ પ્રોવાઈડર દ્રારા KYC દસ્તાવેજોની ચકાસણી પછી NEFT /RTGS/transfer દ્રારા ગ્લોબલ ઈએમડી વોલેટમાં ઈએમડી જમા કરાવવાની રહેશે. (https://www.mstcecommerce.com માં ચલણ બનાવ્યા પછી) વધુ વિગતવાર શરતો અને નિયમો માટે www.centralbankofindia.co.in માં આપેલ લીંક અથવા ઓક્શન પ્લેટફોર્મ https://www.mstcecommerce.com જોવા વિનંતી છે. **હેવ્ય લાઈન નં. ૦૩૩ - ૨૨૯૦૧૦૦૪ અથવા સંબંધિત** શાખા અથવા સંબંધિત અધિકૃત અધિકારી અથવા ક્ષેત્રિય **કાર્યાલય, લાલ દરવાજા, ગાંધીનગર ના અધિકૃત અધિકારી ને** ચાલુ કામકાજના દિવસો દરમિયાન સંપર્ક કરી શકશે.

> સરફેસી એક્ટ - ૨૦૦૨ ના નિયમ ૮(૬) હેઠળ વૈદ્યાનિક ૧૫ દિવસ ની વેચાણ નોટીસ આથી દેવાદારો / જામીનદારો <sup>'</sup> મોર્ગેજરોને સિકયોર્ડ લેણદારના બાકી લેણાંની વસુલાત માટે સ્થાવર મિલકતના વેચાણની જાણ કરવામાં આવે છે.

> > નોંધ : (વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી આવૃતિને માન્ય રાખવામાં આવશે)

અધિકૃત અધિકારી, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિય